

સાઉથ ઓસ્ટ્રેલિયામાં ઇન્ટેન્સિવ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોગ્રામ અને ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ

શિક્ષણ ખાતું ઓસ્ટ્રેલિયામાં નવા આવેલા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં સઘન ટેકો પૂરો પાડે છે. પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમને ઇન્ટેન્સિવ ઇંગ્લિશ લેંગ્વેજ (આઇઇએલપી) પ્રોગ્રામ કહે છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તેને ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ (એનએપી) કહે છે. સાઉથ ઓસ્ટ્રેલિયામાં રહેવા અને અભ્યાસ કરવા માટે જરૂરી અંગ્રેજી શીખવાની સૌથી અસરકારક રીત આઇઇએલપી અથવા એનએપીમાં ભાગ લેવો એ છે.

આઇઇએલપી અને એનએપીના તમામ કેન્દ્રો તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને સૌથી યોગ્ય અભ્યાસક્રમ પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સતત સુધારણા માટે પ્રતિબદ્ધ છે.

દરેક કેન્દ્ર:

- ઓસ્ટ્રેલિયાના અભ્યાસક્રમમાં સફળતા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે
- ઓસ્ટ્રેલિયાના સમુદાયમાં રહેવા માટે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસનો વિકાસ કરે છે.

તે નીચેની રીતે પ્રાપ્ત થાય છે:

- વધારાની ભાષા અથવા બોલી (ઇએએલડી) તરીકે અંગ્રેજીના નિષ્ણાત શિક્ષકો થકી અંગ્રેજી ભાષાનો સઘન ટેકો
- અભ્યાસક્રમના ક્ષેત્રો દ્વારા અંગ્રેજી શીખવું
- પર્યટનો અને સામાજિક કાર્યક્રમો સહિત શાળા અને સમુદાયની અંદર વિવિધ પ્રવૃત્તિઓ
- નાના વર્ગો.

દ્વિભાષી શાળા સેવા અધિકારીઓ, સમુદાયિક સંપર્ક અધિકારીઓ અને દુભાષિયાઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને શિક્ષણ કાર્યક્રમ સાથે જોડાવામાં ટેકો આપે છે.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આઇઇએલપી અથવા એનએપીમાં એક વર્ષ માટે રહે છે. આવશ્યક હોય તો તે લંબાવી શકાય છે.

આઇઇએલપી અથવા એનએપીને પાત્ર થવા માટે વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં આગમનના ૧૨ મહિનાની અંદર અથવા રિસેપ્શન કે વર્ષ ૧માં પ્રવેશતા વિદ્યાર્થીઓના કિસ્સામાં ૧૮ મહિનાની અંદર નોંધણી કરાવવી જરૂરી છે.

કેટલાક વર્ગોના અસ્થાયી વિજ્ઞા ધારકો આઇઇએલપી અને એનએપી માટે પાત્ર નથી અથવા ફી ભરવાની જરૂર પડી શકે છે.

નોંધણીની એપોઇન્ટમેન્ટ લેતી વખતે વિજ્ઞાની વિગતો હોવી જરૂરી છે.

પ્રાઇમરી ઇન્ટેન્સિવ ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોગ્રામ કેન્દ્રો

પ્રાઇમરી (પ્રાથમિક) આઇઇએલપી કેન્દ્રો પથી ૧૨ વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે છે. આ કેન્દ્રો વિવિધ સ્થળોએ છે.

પ્રાથમિક આઇઇએલસીના વર્ગો નાના હોય છે અને વય પ્રમાણે ગોઠવાયેલા હોય છે. અંગ્રેજી ભાષા શીખવાની સાથે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના વિષયો પણ શીખવવામાં આવે છે.

નીચેના વિદ્યાર્થીઓ માટે પરિવહન સહાય ઉપલબ્ધ હોય શકે છે:

- ૧૦ વર્ષથી ઓછી ઉંમર હોય
- જેઓ કેન્દ્રથી ૧.૭૫ કિલોમીટર કરતાં વધુ દૂર રહેતાં હોય.

વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે સંકલન કરવામાં મદદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમની સ્થાનિક શાળામાં સફળતાપૂર્વક તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે તે માટે સંક્રમણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વર્તમાન સઘન અંગ્રેજી ભાષા કાર્યક્રમ ધરાવતી શાળાઓની યાદી માટે, <https://www.sa.gov.au/topics/education-and-learning/international-students/english-language-support/learning-english> અહીં જાઓ.

સેકન્ડરી ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ

૧૨થી ૧૭ વર્ષની વયના નવા આવેલા વિદ્યાર્થીઓને એડિલેડ સેકન્ડરી સ્કૂલ ઓફ ઇંગ્લિશમાં પ્રવેશ આપી શકાય છે. તે એક માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય શાળા છે.

ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ મારફતે શૈક્ષણિક અને વ્યાવસાયિક બંને માર્ગો ઉપલબ્ધ છે.

શાળા નીચેની સહાય પૂરી પાડે છે:

- અંગ્રેજીમાં નિપુણતાના વિવિધ સ્તરને આધારે વર્ગો
- અભ્યાસના ૮ જરૂરી ક્ષેત્રોમાં સઘન અંગ્રેજી
- સમુદાયમાં ભાગીદારી માટેની તકો
- હાઇ સ્કૂલમાં સંક્રમણ માટેનો પ્રોગ્રામ

એડિલેડ સેકન્ડરી સ્કૂલ ઓફ ઇંગ્લિશ

૨૫૩ ટોરેન્સ રોડ, વેસ્ટ કોયડન એસએ ૫૦૦૮

ફોન: (૦૮) ૮૩૪૦ ૩૭૩૩

ઇમેલ: dl.1686.info@schools.sa.edu.au

www.adsecenglish.sa.edu.au

સિનિયર સેકન્ડરી ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ

થીબર્ટન સિનિયર કોલેજ ખાતે સિનિયર સેકન્ડરી ન્યુ અરાઇવલ્સ પ્રોગ્રામ ૧૭ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ, જેઓ પૂર્ણ-સમયના અભ્યાસમાં ભાગ લેવા માંગે છે તેમના માટે પુખ્ત વાતાવરણ પૂરું પાડે છે.

એનએપી અભ્યાસક્રમ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ઓસ્ટ્રેલિયાનું ભૂગોળ અને ઇતિહાસ, કોમ્પ્યુટર, કારકિર્દી શિક્ષણ અને કારકિર્દી આયોજન સહિતના અભ્યાસના ક્ષેત્રો દ્વારા સઘન અંગ્રેજી કાર્યક્રમ પૂરો પાડે છે. તે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અને રોજગાર માટે તૈયાર કરશે.

થીબર્ટન સિનિયર કોલેજ

૪૦ એશ્લી સ્ટ્રીટ, ટોરેન્સવિલ

ફોન: (૦૮) ૮૩૫૨ ૫૮૧૧

ઇમેલ: info@tsc.sa.edu.au

www.tsc.sa.edu.au